

શું હું પબ્લિક ચાર્જ બની જઈશ?



મિની જ્યારે B-1/B-2 વિઝા પર અમેરિકામાં દાખલ થઈ ત્યારે છ મહિનાનો ગર્ભ એના પેટમાં હતો. એને થોડો સમય અમેરિકામાં રહીને ઈન્ડિયા પાછા આવતા રહેવું હતું, પણ ત્યાં એની તબિયત બગડી. કામિનીના કાકા જે અમેરિકામાં સિટીઝન હતા. એમણે એને અમેરિકાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી અને દીકરીના જન્મ બાદ કામિનીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. કામિનીને એવું લાગ્યું કે કદાચ એના કાકાએ જ હોસ્પિટલનું બિલ ભરી દીધું હશે અથવા તો એણે એવું પણ સાંભળ્યું હતું કે અમેરિકાની હોસ્પિટલો જો તમારી પાસે પૈસા ના હોય તો તમને માફ કરીને જવા દેતી હોય છે આથી એણે કંઈ જાણવાની તસ્દી ના લીધી અને ભારત પાછી આવી ગઈ.

કામિનીની દીકરી અમેરિકાની ધરતી પર જન્મી હતી એટલે એણે અમેરિકન સિટીઝન તરીકે પોતાની માતા માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું. આ પિટિશન એપ્રુવ થઈ કરંટ થયું એટલે કામિની ઈમિગ્રન્ટ વિઝા લેવા ઈન્ટરવ્યૂમાં ગઈ. કામિનીના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા. એને કારણ આપવામાં આવ્યું કે તમે જો અમેરિકાની ધરતી પર આવશો તો અમારી જનતા અને ગવર્નમેન્ટ પર બોજારૂપ થઈ પડશે એટલે કે ‘પબ્લિક ચાર્જ’ થઈ જશો.

કામિનીએ અમેરિકાની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતી વખતે પૈસા ભરી દીધા હોત અને એની રસીદો સાચવી રાખી હોત તો એ બતાવી શકત કે એ અમેરિકામાં મળતી સગવડનો ગેરલાભ લેવા નહોતી માગતી. બીજું, એની દીકરી જેણે એના માટે પિટિશન દાખલ કર્યું એની આવક ખૂબ જ ઓછી હતી એટલે એ એની માતાને સ્પોન્સર કરવા સક્ષમ નહોતી. તો કામિનીએ પોતાની ઈન્ડિયાની આવક જે ઘણી હતી એ બતાવવી જોઈતી હતી. એણે કહેવું જોઈતું હતું કે પોતે ઘણા પૈસા લઈને અમેરિકા જવાની છે. એનું નેટવર્થ સર્ટિફિકેટ ઘણું સધ્ધર છે અને એણે અમેરિકામાં જ કોસ્પોન્સર બતાવવો જોઈતો હતો. જે એને અમેરિકામાં બોજારૂપ બનતી અટકાવી દે. કામિની પોતે પણ ભણેલી છે, એને કોઈ પ્રકારની બીમારી નથી અને અમેરિકામાં કામધંધો કરીને કમાવા માટે સક્ષમ છે, તો કામિનીને વિઝા મળી જાત.

રાકેશ 30 વર્ષનો છે. H-1B પર અમેરિકામાં નોકરી કરે છે. તેની પત્ની પણ ગ્રેજ્યુએટ થયેલી છે. રાકેશ પાસે બેંકમાં 30,000 ડોલર્સનું બેલેન્સ છે. તેની



કામિનીએ અમેરિકાની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતી વખતે પૈસા ભરી દીધા હોત અને એની રસીદો સાચવી રાખી હોત તો એ બતાવી શકત કે એ અમેરિકામાં મળતી સગવડનો ગેરલાભ લેવા નહોતી માગતી

વાર્ષિક આવક 90,000 ડોલર્સ છે. રાકેશ પત્ની માટે H-4 વિઝાનું નોનઈમિગ્રન્ટ પિટિશન દાખલ કર્યું. પત્નીને ઈન્ટરવ્યૂમાં તુરંત વિઝા આપવામાં આવ્યા. કારણ કે બીજો કોઈ જ પ્રોબ્લેમ નહોતો અને રાકેશ પૈસેટકે સધ્ધર હતો, એટલે એની પત્ની કોઈપણ રીતે પબ્લિક ચાર્જ થવાની શક્યતા નહોતી.

રીતુ અમેરિકન સિટીઝન છે, પણ યુનિવર્સિટીમાં ભણે છે. એની આવક વર્ષે 12,000 ડોલર્સ જ છે. તેણે તેના ફિયાંસ પ્રિયેશ માટે K-1 વિઝાનું પિટિશન દાખલ કર્યું. પ્રિયેશના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા. કારણ આપ્યું, તમારી ફિયાંસી રીતુની આવક ખૂબ ઓછી છે. કમસેકમ બે જણના પરિવાર માટે વાર્ષિક 25,550 ડોલર્સની આવક હોવી જરૂરી છે. રીતુએ ફરી પાછું પિટિશન

દાખલ કર્યું. એમાં એની મમ્મીને જોઈન્ટ સ્પોન્સર બતાવી. મમ્મીની વાર્ષિક આવક 80,000 ડોલર્સ હતી, એટલે પ્રિયેશના પબ્લિક ચાર્જ થવાની શક્યતા ન રહે. એને કોન્સ્યુલેટે K-1 વિઝા આપી દીધા.

તમે જ્યારે અમેરિકાના કોઈપણ પ્રકારના વિઝા લેવા જાઓ ત્યારે કોન્સ્યુલર ઓફિસર એ જાણવા માંગે છે કે જે ટ્રાવેલ કરનાર છે એ અથવા તો એને સ્પોન્સર કરનાર છે એ પોતે કેટલા સધ્ધર છે. એ અમેરિકા માટે બોજારૂપ એટલે કે પબ્લિક ચાર્જ તો નહીં બની જાય ને? જો એની ઉંમર 60 વર્ષથી વધુ હશે તો એ કામધંધો નહીં કરી શકે, નોકરી નહીં કરી શકે અને અમેરિકાની સરકાર જે ગરીબોને સગવડ આપે છે એનો પૂરેપૂરો લાભ લેશે. જો ઈન્ટરવ્યૂ આપનાર વ્યક્તિ સાધારણ બ્લડપ્રેશર

વિઝા મિશ્ર

★ સંગીતા જોશી

કેબિટ કાર્ડ સાથે મળતો ઈન્શ્યોરન્સ બેનિફિટ : કાર્ડ હોલ્ડરે શરતોનું પાલન કર્યું હશે તો જ મળશે



ખરીદીનો વ્યવહાર કાર્ડથી થાય તે પણ જરૂરી હતું. પરંતુ વિનયકુમારના ખાતામાં Minimum Balance જળવાયું ન હતું. વધુમાં, નાણાંકીય વર્ષમાં કાર્ડ વડે કોઈ ખરીદી યા કોઈ પેમેન્ટનો વ્યવહાર પણ થયો ન હતો. કાર્ડ હોલ્ડરનું પાછળથી અકસ્માત મૃત્યુ થતાં તેના વારસદારોએ અકસ્માત મૃત્યુ

અન્વયે મળવાપાત્ર રકમનો ક્લેમ કરતાં વીમા કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો હતો. જેથી કાર્ડ હોલ્ડરના વારસદારોએ બેંક અને વીમા કંપની વિરુદ્ધ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ જિલ્લા ફોરમે મંજૂર કરી અકસ્માત મૃત્યુના ક્લેમની રકમ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. જેથી

કે ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતી હશે અને એને સ્પોન્સર કરનાર વ્યક્તિ એની ટ્રીટમેન્ટ કરવા સક્ષમ નહીં હોય તો પણ કોન્સ્યુલેટ એને વિઝા નહીં આપે. એ ડરે કે આગળ જતાં એ અમેરિકા અને અમેરિકનો પર બોજારૂપ બની જશે એટલે કે પબ્લિક ચાર્જ બની જશે.

અમેરિકામાં જવા માટે ઈન્ટરવ્યૂ આપનારે પબ્લિક ચાર્જ હેઠળ એના વિઝા રિજેક્ટ ન થઈ જાય એ માટે નીચે દર્શાવેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે.

એક તો એની પોતાની આવક, બેંક બેલેન્સ, પ્રોપર્ટી અને એસેટ પૂરતી હોય જેથી એ અમેરિકામાંથી મદદ ન માંગે. જો એની આવક પૂરતી ન હોય તો એણે અમેરિકામાં રહેતા સગાસંબંધી પાસે સ્પોન્સરશિપ લેવી જોઈએ. જો એકની આવક પૂરતી ન હોય તો જોઈન્ટ સ્પોન્સર પણ લઈ લેવા જોઈએ. ઈમિગ્રન્ટ વિઝા પર જનાર વ્યક્તિની ઉંમર 60થી વધુ હોય તો એની પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ હોવો જરૂરી છે. એ પણ એક પ્લસ પોઈન્ટ ગણાશે. જો 60 વર્ષથી નીચેની ઉંમર હોય અને એની પાસે નોકરીની ઓફરનો પત્ર હોય તો એ પણ એને પબ્લિક ચાર્જ બનતા અટકાવે છે. આ બધા ઉપાયો કરવાથી તમે પબ્લિક ચાર્જ બનતા અટકશો અને તમને વિઝા મળવાની શક્યતાઓ વધી જશે.

17 જુલાઈ, 2026 થી ટ્રમ્પની સરકારે નવા રૂલ કર્યા છે અને ફેડરલ ગવર્નમેન્ટની પોલિસી ચેન્જ કરી છે. એના હેઠળ ઈમિગ્રેશન ઓફિસરને ફક્ત વ્યક્તિ અમેરિકામાં પબ્લિક ચાર્જ બની જશે એવી થોડીક પણ શક્યતાઓ દેખાતી હોય તો એને અમેરિકામાં કોઈપણ કારણ આપ્યા વગર ‘તમે પબ્લિક ચાર્જ બનશો.’ ફક્ત એટલું કહીને આવતા અટકાવવાની એટલે કે એના વિઝા રિજેક્ટ કરવાની સત્તા આપવામાં આવી છે. પબ્લિક ચાર્જની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરવામાં નથી આવી. આથી ઈન્ટરવ્યૂ આપવા જનારે પોતે જ સાવધાનીપૂર્વક પોતાની આવક અને સ્પોન્સર કરનારની આવક બતાવવી પડશે. કેટલાય ગ્રીનકાર્ડધારકો જે સિટીઝન બનવાની રાહ જોઈને બેઠા હોય તેઓ પણ હવે તેઓને અમેરિકાની સરકારના અમુક અધિકારો મળવાની લાયકાત હોય તો પણ એનો ઉપયોગ કરતા નથી. જેથી કરીને સિટિઝનશીપ મેળવતી વખતે તેમને પબ્લિક ચાર્જ ગણી ન લેવામાં આવે.

તો વિઝામિત્રો, તમારી આવક અને એસેટને વ્યવસ્થિત કરો અને પછી અમેરિકાના વિઝા માટે અપ્લાય કરો.

કેબિટ યા કેડિટ કાર્ડ અન્વયે કોઈક પ્રકારના ઈન્શ્યોરન્સનો બેનિફિટ જોડાયેલો હોય ત્યારે જેતે ઈન્શ્યોરન્સની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ જાણી-સમજી લઈ તે મુજબ અમલ કરવાનું સલાહભર્યું રહેશે

વીમા કંપનીએ ગુજરાત સ્ટેટ કમિશન સમક્ષ અપીલ કરતાં સ્ટેટ કમિશને પણ અપીલ નામંજૂર કરતાં મામલો નેશનલ કમિશન સમક્ષ પહોંચ્યો હતો.

નેશનલ કમિશને કાર્ડ હોલ્ડર-ગ્રાહકના પક્ષે જ ઈન્શ્યોરન્સની શરતોનો ભંગ થયો હોવાનું ઠરાવી અકસ્માત મૃત્યુનો ક્લેમ ચૂકવવા વીમા કંપની જવાબદાર ન હોવાનું ઠરાવ્યું હતું.

સારાંશ એ કે કેબિટ (યા કેડિટ) કાર્ડ અન્વયે કોઈક પ્રકારના ઈન્શ્યોરન્સનો બેનિફિટ જોડાયેલો હોય ત્યારે જેતે ઈન્શ્યોરન્સની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ જાણી-સમજી લઈ તે મુજબ અમલ કરવાનું સલાહભર્યું રહેશે.

કેન્ડલ લાઇટ

કાળ સામે હણહણે તે પ્રેમ છે.

પાંગરે અરધી ક્ષણે તે પ્રેમ છે.

— ભગવતીકુમાર શર્મા



કમાં ખાતું ખોલાવતી વખતે ગ્રાહકને કેબિટ કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાય છે. આ કેબિટ કાર્ડની સાથે કેટલીક વાર કાર્ડ હોલ્ડરને પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર પણ આપવામાં આવે છે પરંતુ આ ઈન્શ્યોરન્સ કવર શરતી હોય છે અને કાર્ડહોલ્ડર ગ્રાહકે જો આ ઈન્શ્યોરન્સની શરતોનું પાલન કર્યું હશે તો જ આ ઈન્શ્યોરન્સનો લાભ મળી શકશે.

નેશનલ કમિશને (સર્વોચ્ચ ગ્રાહક અદાલત) બજાજ એલિઆન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિ. વિ. એક્સીસ બેંક લિ. ની રિવિઝન પિટિશનમાં આપેલો ચુકાદો, આ મુદ્દા પર પ્રકાશ પાડનારો છે.

આ કેસમાં વિનયકુમારે એક્સીસ બેંકમાં ખાતું ખોલ્યું હતું. બેંકે તેમને ગોલ્ડ કેબિટ કાર્ડ તરીકે ઓળખાતો કેબિટ કાર્ડ પણ ફાળવ્યો હતો. કેબિટ કાર્ડ અન્વયે પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સનો બેનિફિટ કાર્ડ હોલ્ડરને ઉપલબ્ધ થતો હતો. કાર્ડ હોલ્ડરના અકસ્માત મૃત્યુ(એક્સિડન્ટ ડેથ) ના સંજોગોમાં તેના વારસદારને રૂ. ૧.૫ લાખનો ઈન્શ્યોરન્સ ક્લેમ મળવાપાત્ર હતો પરંતુ ઈન્શ્યોરન્સ બેનિફિટ પ્રાપ્ત થાય તે માટે બે શરતોનું પાલન જરૂરી હતું.

૧. ખાતાનું Minimum Balance રૂ. ૨૫૦૦ જાળવવું જરૂરી હતું.

૨. નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછો એક

ગ્રાહક મંચ

★ શ્રેયસ દેસાઈ (એડવોકેટ)